



આસ્વાન

A MONTHLY BULLETIN OF SHAHPUR METHODIST CHURCH

Address : Bahai Center, Shahpur, Ahmedabad 380 001.

Email : rev.arvindkhrishi@gmail.com

Visit us at : www.shahpurmethodistchurch.com

Pastor : Rev. Arvind R. Khristi

Ph. : 079-25503545 (M) 9913070647

વર્ષ - ૫૧

માર્ચ - ૨૦૨૩

પૃષ્ઠ - ૧૧૫

પ્રાર્થના

પ્રાર્થના વિશ્વાસી જીવનની એક ખૂબ જ અગત્યની બાબત છે. વિશ્વાસી વ્યક્તિ એ હંમેશા પ્રાર્થના કરનાર હોય છે. પ્રાર્થના સિવાય વિશ્વાસી વ્યક્તિ જીવી શકતી નથી. મંડળી પણ પ્રાર્થના કરનાર હોવી જોઈએ. આ દિવસોમાં આપણે પ્રાર્થનાને ખૂબ મહત્વ આપી અને પ્રાર્થનામાં સમય ગાળવો જોઈએ. પ્રાર્થના એ પ્રભુ સાથેનો જીવંત સંબંધ છે.

પ્રેરિતોનાં કૃત્યોમાં મંડળી પ્રાર્થનામાં લાગુ રહેલી જોવા મળે છે. પ્રાર્થનાની શૈલી-ઢબ પણ જોવા મળે છે. જે આ પ્રમાણે છે.

(૧) એક ચિત્તની પ્રાર્થના : પ્રાર્થના એક ચિત્તથી કરવા સંબંધી માથ્થી ૧૮:૧૮માં કહેવામાં આવ્યું છે. પ્રેરિતોનાં કૃત્યો ૧:૧૪ અને ૨:૪૬માં એક ચિત્તથી હાજર રહી પ્રાર્થના કરતા હતા તે જોવા મળે છે. એક ચિત્ત એટલે પૂરા વિશ્વાસથી, સંદેહ રાખ્યા સિવાય પ્રાર્થના કરવી જોઈએ. જેમ ધનુષ્યમાંથી તીરને પૂરા જોરથી ખેંચી છોડવામાં આવે છે તેવી રીતે પ્રાર્થના કરવી જોઈએ. હૃદયમાંથી પૂરા આત્મિક બળથી પ્રાર્થના કરવી જોઈએ. ૧ શમુએલ ૧:૧૨માં હાન્ના આવી રીતે એટલે કે તલ્લીન થઈને પ્રાર્થના કરે છે. એક ચિત્ત એટલે શારીરિક, માનસિક અને આત્મિક રીતે પ્રભુમાં લીન થવાનું છે. ભટકતા વિચારો, આવેગો, ઉચાટ, ચિંતા, પ્રશ્નો, દ્વેષ, કડવાશ, ઈર્ષ્યા મુક્ત બની અને પ્રભુમાં એક ચિત્ત રાખીને પ્રાર્થના કરવી જોઈએ.

(૨) પસ્તાવિક હૃદયોની સાથે પ્રાર્થના : પ્રેરિતોનાં કૃત્યો ૨:૩૭-૪૧માં પિતરના ભાષણ બાદ લોકોએ પસ્તાવો કર્યો. તેઓના મન વિંધાઈ ગયા હતા એટલે કે નમ્ર બની પોતાના પાપોનો પસ્તાવો કરે છે. આ લોકો પ્રાર્થનામાં દઢતાથી લાગુ રહ્યા. લૂક ૧૮:૧૩માં દાણીએ વેગળે ઉભા રહી છાતી કૂટીને દેવને કહ્યું કે હું પાપી છું મારા પર દયા કર. પોતે પાપી છે તેનો સ્વીકાર, કબૂલાત જોવા મળે છે. આ માણસ ન્યાયી ઠરીને ઘરે જાય છે. લૂક ૧૫:૨૧માં દીકરો કબૂલ કરે છે મેં આકાશ સામે પાપ કર્યું છે. તેનો સ્વીકાર કરવામાં આવે છે.

(૩) દઢતાવાળી પ્રાર્થના : પ્રેરિતોના કૃત્યો ૨:૪૨માં શરૂઆતની મંડળી દઢતાથી પ્રાર્થનામાં લાગુ રહી તેમ જણાવે છે. તેઓની દઢ અને મજબૂત પ્રાર્થના જોવા મળે છે. ખૂબ જ તટસ્થ રીતે ફેરફાર કે બદલાયા સિવાય તેઓ પ્રાર્થનામાં દઢ રહ્યા. પૂરા વિશ્વાસથી પ્રભુને સમર્પિત થઈને પ્રાર્થના કરે છે. બાલાઓ આપણે આવી રીતે પૂરા સમર્પિત થઈ અને વિશ્વાસથી પ્રાર્થના કરનાર બનીએ.

(૪) નિયમિત : પ્રેરિતોના કૃત્યો ૨:૪૬માં લખવામાં આવ્યું છે કે તેઓ નિત્ય પ્રાર્થનામાં મળતા હતા, ભોજન કરતા હતા. આ લોકોના જીવનમાં આ એક રોજંદો ભાગ બની ગયો હતો. સમયાંતરે નહિ પણ નિત્ય સાથે મળી સ્તુતિ કરતા હતા. તેઓનો આ નિત્યક્રમ જોવા મળે છે.

બાલાઓ, આ દિવસોમાં આપણે આવી રીતે પ્રાર્થના કરનાર દેવના લોકો બનીએ અને આશીર્વાદિત થઈએ.

BIRTHDATE IN MARCH

૬/૩ આલાપભાઈ જે. માસ્ટર	૧૨/૩ સુહાસીનીબેન ટી. રૂબી	૨૬/૩ મેરેલીન એન. ચૌહાણ
૬/૩ સુનિલભાઈ એસ. સોલંકી (USA)	૧૩/૩ જીની જે. મેકવાન	૨૮/૩ કલ્પનાબેન વી. ક્રિસ્ટી
૭/૩ શરદકુમાર બી. વાઘેલા	૨૩/૩ જોય એ. ખ્રિસ્તી	૨૮/૩ સિલાસભાઈ જી. ચૌહાણ
૮/૩ રીટાબેન જે. કીન	૨૪/૩ સત્યવતીબેન વી. દાસ	૩૧/૩ નિલેશભાઈ આર. રાઠોડ
૧૨/૩ રીનાબેન જે. દાસ	૨૫/૩ ટર્વીકલ વી. ક્રિસ્ટી	

જાહેરાતો

● તા. ૨૬-૩-૨૩ રવિવારે અંમદાવાદ ડિસ્ટ્રિક્ટ વેસ્ટની ભજનસેવા થશે. માનવંત બિશપ એન. એલ. કરકરે સાહેબના હસ્તે પૂર્ણ સભાસદ બનાવવામાં આવશે. ● તા. ૨-૪-૨૩ રવિવારે સ્થાનિક ચર્ચ શરૂઆતના ૫૦ વર્ષ પૂર્ણ થતાં હોવાથી પવિત્ર બાઈબલના ૫૦મા પુસ્તક ફિલિપ્પીઓને પત્રની લેખિતમાં બાઈબલ ક્વીઝ ભજનસેવા બાદ લેવામાં આવશે. જેમાં દરેક સભ્ય ભાગ લેશે. તૈયારી કરશે. ● લેન્ટની ૪૦ દિવસોની મિટિંગોમાં હાજરી આપશો. ● તા. ૩૧-૩-૨૩ના રોજ નાણાંકીય વર્ષ પૂર્ણ થતું હોવાથી આપના દાનો જમા કરાવશો. ● લેન્ટ અને દુ:ખ સહન સંપ્રદાઈની સભાઓ માટે પ્રાર્થના કરશો. ● ધો. ૧૦ અને ૧૨ની પરિક્ષા આપનાર વિદ્યાર્થી ભાઈ-બહેનોને શુભેચ્છા. તેઓ માટે પ્રાર્થના કરશો. ● રવિવારની ભજનસેવામાં કુટુંબ સાથે હાજરી આપશો.

આ બુલેટીન છાપવાનો તમામ ખર્ચ પ્રભુ પ્રેમી એક દાતા તરફથી મળેલ છે.

ગત માસના કાર્ય તરફ દૃષ્ટિપાત

- તા. ૩-૨-૨૩ શુક્રવારની પ્રાર્થના સંગત ચર્ચામાં ચલાવવામાં આવી. યહુદાના પત્ર પર અભ્યાસ શરૂ કર્યો.
- તા. ૫-૨-૨૩ રવિવારની ભજનસેવા ચલાવવામાં આવી. આ વર્ષે ચર્ચના ૫૦ વર્ષ પૂર્ણ થતા હોવાથી સ્થાનિક ચર્ચના ૬૫ વર્ષથી ઉપરના ૪૦ સભ્યોનું ચર્ચ તરફથી ગુલાબનું ફુલ આપી અને શોલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું. પ્રભુભોજન પળાવવામાં આવ્યું. શ્રી સમીરભાઈ એસ. ભાટીયા તરફથી સર્વના માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. સ્થાનિક ચર્ચ, પાસ્ટોરેટ કમિટી અને શ્રી સમીરભાઈ ભાટીયાનો આભાર. આ કાર્યક્રમ ખૂબ જ આશીર્વાદિત રહ્યો હતો.
- તા. ૧૧-૨-૨૩ ડિસ્ટ્રીક્ટના પાળકોની પ્રાર્થના સંગત મેથોડિસ્ટ ચર્ચ રાયખડમાં મળી. ડિ. સુ. રેવ. વિજય મેકવાન સાહેબે વચન આપ્યું. સર્વ માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી.
- તા. ૧૨-૨-૨૩ રવિવારની ભજનસેવા ચલાવી. ભજનસેવા બાદ પાસ્ટોરેટ કમિટી મળી.
- તા. ૧૪-૨-૨૩ શ્રીમતી લીનાબહેન પેટ્ટીકના મમ્મી નિરંજનાબહેન પ્રભુમાં ઊઘી ગયા. તેઓની દફનવિધિમાં કાર્મલપાર્ક સોસાયટી, સી.ટી.એમ. માં હાજરી આપી અને વચનની સેવા આપી.
- તા. ૧૭-૨-૨૩ ઓલ્ટ્રીય ઓ. ગામડિયાના લગ્નના મંડપની પ્રાર્થના સવારે ૮-૦૦ વાગે કરવામાં આવી. બપોરે બહેરામપુરામાં તેઓની સગાઈ વિધિમાં હાજરી આપી. સાંજે સી.એન.આઈ. ચર્ચ, એલિસબ્રીજમાં તેઓના લગ્નની આભારસ્તુતિની મિટીંગ ચલાવવામાં આવી.
- તા. ૧૮-૨-૨૩ સી.એન.આઈ. ચર્ચ, બહેરામપુરામાં ઓલ્ટ્રીય-થેતલની લગ્નની ભજનસેવામાં હાજરી આપી.
- તા. ૧૯-૨-૨૩ રવિવારની ભજનસેવા ચલાવી. ભજનસેવામાં ઓલ્ટ્રીય-થેતલ લગ્નગ્રંથિથી જોડાયા. તેઓનો આવકાર કરી અભિનંદન આપી અને ચર્ચ તરફથી બાઈબલ સપ્રેમ ભેટ આપવામાં આવ્યું. ભજનસેવા બાદ પુનર્નિયમ પુસ્તકના ૧૮ થી ૩૪ અધ્યાય પ્રમાણે લેખિત બાઈબલ કવીઝ લેવામાં આવી. ભાગ લેનાર સભ્યોનો આભાર અને અભિનંદન.
- તા. ૨૨-૨-૨૩ સાંજે ૮-૦૦ વાગે ચર્ચમાં લેન્ટની પ્રથમ મિટીંગ પ્રાર્થના સાથે શરૂ કરવામાં આવી. 'પ્રાર્થના' સંબંધી વિષય નક્કી કરી વચન આપવામાં આવ્યું. શ્રી એન્યનીભાઈ એ. કિશ્ચિયનના દિકરી એની આકાશ સાથે લગ્નથી જોડાયાનું એક વર્ષ પૂર્ણ થતાં એન્યનીભાઈ તરફથી સર્વને આઈસ્ક્રીમ આપવામાં આવી. આભાર.
- તા. ૨૩-૨-૨૩ લેન્ટની બીજી મિટીંગ શ્રી એન્યનીભાઈ એ. કિશ્ચિયનના ઘરે ખાનપુરમાં મળી. કુટુંબ તરફથી સર્વને નાસ્તો-કંડા પીણા આપવામાં આવ્યા. આભાર.
- તા. ૨૬-૨-૨૩ રવિવારની ભજનસેવા ચલાવવામાં આવી. આ ભજનસેવામાં શ્રી એન્યની એસ. ઈમાનુએલના દીકરી એવીસનું બાપ્તિસ્મા આપવામાં આવ્યું. ધોરણ-૧૦ અને ૧૨ના વિદ્યાર્થી ભાઈ-બહેનોને શ્રી મનોજભાઈ-શ્રીમતી ડાયનાબહેન ચૌહાણ કુટુંબ તરફથી પેન અને લેટર-પેડ આપવામાં આવ્યા. ચર્ચનાં બાળકોને ઉભા કરી ખાસ પ્રાર્થના સાથે શુભેચ્છા આપવામાં આવી. શ્રી મનોજભાઈ ચૌહાણ કુટુંબનો આભાર. શ્રી નિલય-શ્રીમતી મેરેલીન ચૌહાણ દ્વારા તેમના બાળકો એસલીન અને એરિક તરફથી વાયરલેસ સ્પીકર આપવામાં આવ્યું. પ્રાર્થના સાથે અર્પણ કરવામાં આવ્યું. શ્રી નિલય ચૌહાણ કુટુંબનો આભાર.
- ભજનસેવા બાદ શ્રી એન્યની એસ. ઈમાનુએલ અને શ્રીમતી રીન્કીનાબહેન ઈમાનુએલ તરફથી તેમની દીકરી એવીસના બાપ્તિસ્મા પ્રસંગ નિમિત્તે સર્વને ચ્હા-નાસ્તો આપવામાં આવ્યો. આભાર.
- તા. ૨૭-૨-૨૩ માયુષ એડવીન રાઠોડનું દુઃખદ અવસાન થયું. સાંજે ૬-૦૦ વાગે તેમના નિવાસસ્થાન ૪, વિજયા એપાર્ટમેન્ટ, મણીનગરમાં પુનરુત્થાનની મહાન આશામાં દફનવિધિ કરવામાં આવી. દુઃખી પરિવારને પ્રભુ દિલાસો આપો. દુઃખી પરિવાર માટે પ્રાર્થના કરશો.
- લગ્નગ્રંથિથી જોડાયેલ શ્રી ઓલ્ટ્રીય - શ્રીમતી થેતલ ગામડિયા તરફથી સન્ડેસ્કૂલના બાળકોને ચોકલેટ અને વર્ષ દરમિયાન બુકે-ફુલહાર આપવામાં આવશે. પુષ્કળ આભાર.

પાળક દ્વારા મળેલ બર્થડે અને આભાર સ્તુતિના દાન

૧. શ્રી રાજએસ. શાહ	એ. ફંડ	૧૦૦૦
૨. શ્રીમતી આશાબહેન સી. વરસડા	બર્થડે	૫૦૦
૩. શ્રીમતી મોનિકાબહેન એસ. ડેવિડ	બર્થડે	૫૦૦
૪. એનન એલ. પેલમોર	બર્થડે	૫૦૦
૫. કુ. પ્રિયંકા એન. કિશ્ચિયન	બર્થડે	૨૦૦
૬. કુ. વાયોલેટ વી. કિશ્ચિયન	બર્થડે	૧૦૦૦
૭. શ્રી કેનેથ એફ. ટેલર	બર્થડે	૫૦૦
૮. કુ. સિલિયાબહેન એસ. મેકવાન	આ.સ્તુ.	૫૦૦
૯. શ્રીમતી મધુબહેન જે. કિશ્ચિયન	બર્થડે	૫૦૦
૧૦. શ્રી શરદભાઈ બી. વાઘેલા	આ.સ્તુ.	૨૦૦
૧૧. શ્રી માયુષભાઈ એ. રાઠોડ	બર્થડે	૨૦૦
૧૨. જેક એમ. રાઠોડ	બર્થડે	૨૦૦
૧૩. શ્રીમતી પારૂલબહેન ઓ. ગામડિયા	આ.સ્તુ.	૫૦૦
દીકરા ઓલ્ટ્રીયના લગ્ન પ્રસંગે આ.સ્તુ. મિટીંગ		
૧૪. શ્રીમતી શીલાબહેન એમ. પટેલ	આ.સ્તુ.	૨૫૦૦
પ્રભુએ સાજાપણું આપવા બદલ		
૧૫. શ્રીમતી શીલાબહેન એમ. પટેલ	એ. ફંડ	૧૦૦૦
૧૬. શ્રીમતી શીલાબહેન એમ. પટેલ	પુ. ફંડ	૧૫૦૦
૧૭. શ્રી ઓલ્ટ્રીય અને શ્રીમતી થેતલ ગામડિયા	આ.સ્તુ.	૫૦૦
ના લગ્નનું દાન		
૧૮. શ્રીમતી પારૂલબહેન ઓ. ગામડિયા	આ.સ્તુ.	૧૦૦૦
ઓલ્ટ્રીયના લગ્ન થેતલ સાથે થવાથી		
૧૯. શ્રીમતી ફેનીબહેન એ. કિશ્ચિયન	બર્થડે	૨૫૦
૨૦. શ્રીમતી મંજુલાબહેન એસ. ખ્રિસ્તી	બર્થડે	૫૦૦
૨૧. શ્રી આકાશ અને શ્રીમતી એની રાઠોડ	લગ્ન દિ. દાન	૫૦૦
લગ્નનું એક વર્ષ પૂર્ણ થતાં		
૨૨. શ્રીમતી રોઝમેરી એ. ખ્રિસ્તી	બર્થડે	૫૦૦
૨૩. શ્રી અતુલભાઈ પી. મહિડા	બર્થડે	૫૦૦
૨૪. શ્રીમતી શર્મિલાબહેન એસ. અર્લિક	આ.સ્તુ.	૨૫૦
૨૫. કુ. શ્રેયાંસી એસ. અર્લિક	આ.સ્તુ.	૨૫૦
૨૬. કોલીન એ. કિશ્ચિયન	બર્થડે	૫૦૦
૨૭. શ્રીમતી થેતાલી કે. મહિડા	બર્થડે	૫૦૦
૨૮. શ્રી રશ્મિકાંત પી. મહિડા	આ.સ્તુ.	૧૦૦૦
તંદુરસ્તી મળવા બદલ		
૨૯. શ્રીમતી પ્રકૃતિ એ. ફેન્ક	બર્થડે	૫૦૦

નાણાંકીય અહેવાલ જાન્યુઆરી-૨૦૨૩

તા. ૦૧-૦૧-૨૩ ની ઉઘડતી સિલક		
રોકડ	૨,૫૩,૬૩૨.૮૮	
બેંકમાં	૨,૭૯,૦૭૩.૧૪	
જાન્યુઆરી-૨૩માં થયેલ		
આવક	૩,૩૩,૧૩૧.૪૫	
કુલ	૮,૬૫,૮૩૭.૪૭	
તા. ૩૧-૦૧-૨૩ની બંધ સિલક		
રોકડ	૧,૮૨,૮૩૨.૮૮	
બેંક	૫,૭૧,૫૬૬.૫૯	
જાન્યુઆરી-૨૩માં થયેલ		
જાવક	૧,૦૧,૪૩૮.૦૦	
કુલ	૮,૬૫,૮૩૭.૪૭	

શ્રી શરદભાઈ જે. માસ્ટર, ટ્રેઝરર